

ઉધના ગાંધીકુટીર સોસાયટીમાં મોબાઇલની દુકાનમાં થયેલ ચોરીનો ભેદ ચોવીસ કલાકમાં ઉકેલતી ઉધના પોલીસ ટીમ

તા.૦૫/૦૨/૨૦૧૭ ના કલાક- ૧૯/૫૦ વાગ્યે ફરીયાદી નામે રણજીતકુમાર અભિમન્યુ સાવત ઉવ-૩૦ ધંધો-વેપાર રહે- પ્લોટ નં ૯૬, શ્રીરામ કુટીર વિનોદ ચોક પાસે ઉધના સુરતનાઓની ઓમ મોબાઇલ સેન્ટર નામની મોબાઇલની દુકાનમાંથી અજાણ્યા ચોર ઇસમોએ દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાં રાખેલ નવા અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ- ૨૭ તથા મોબાઇલની એસેસરીઝ મળી કુલ્લે કિ.રૂ. ૫૯,૭૫૭/- ના મત્તાની મોબાઇલની દુકાનમાંથી ચોરી કરી લઇ ગયેલ જે બાબતે ઉધના પો.સ્ટે. I ૨૦/૨૦૧૭ ઈ.પી.કો કલમ ૪૫૪,૪૫૭,૩૮૦મુજબનો ગુન્હો દાખલ થયેલ

જે ઉપરોક્ત ગુન્હા સબંધે મે.ડી.સી.પી ઝોન - ૧ શ્રી આર.પી.બારોટ સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર બી ડીવીઝન શ્રી આર.એલ.પટેલ સાહેબ નાઓનીસુચના અને માર્ગદર્શન મુજબ ઉધના પોલીસ ઇન્સપેક્ટર શ્રી સી.આર.જાદવ સાહેબ નાઓની આગેવાની હેઠળ ઉધના પો.સ્ટે. ના સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોની ટીમ બનાવી ઉધના પો.સ્ટે. વિસ્તારમાં દિવસની તથા રાત્રીની ઘરફોડ ચોરી તથા શરીર સંબંધીના અનડીટેક્ટ ગુન્હા અંગે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અ.પો.કો.હર્ષદસિંહ સિંઘવતથા અ.પો.કો. રાજેશ ભરડાનાઓને મળેલ સંયુક્ત બાતમી હકિકતના આધારે આરોપી નામે (૧) નિલાંચલ પદમચરણ પાત્ર ઉવ ૨૩ રહે હરીનગર ૩ બાબુભાઈની મેસમા પ્લોટ નં ૬૯ ઉધના સુરત મુળગામ સીંગીપુરગામ તાલુકો ધરાકોટ જિલ્લો ગંજામ પોસ્ટ સીંગીપુર (ઓરીસ્સા) (૨) સુનીલ ઇન્દ્રમણી બારી ઉ.વ ૨૩ રહે પ્લોટ નં ૨૪૫, ગાંધીકુટીર ગલી નં ૫ ઉધના સુરત ઉધના સુરત મુળવતન નવાગામ પોસ્ટ શીયાળીયા જિલ્લો ગંજામ ઓરીસ્સાનાઓને બાતમી આધારે પકડી પાડી તેઓની પાસેથી એક પતરાની પેટીમાંથી મોબાઇલ એસેસરીઝ જેમાં (૧) રાજશ્રી કંપનીનું સોલ્ડર મશીન કિંમત રૂ. ૪૦૦/- તથા હેવી ડીજીટલ કંપનીનું મલ્ટી મીટર કિંમત રૂ.૧૬૦/- તથા યુબોન કંપનીનું મલ્ટી પ્લગ તથા આઈ બોલ કંપનીનો યુ.એસ.બી. પોર્ટ કિંમત રૂ ૨૫૦/- તથા સનડીસ્ક કંપનીના મેમરી કાર્ડો જેમા (૧) ૧૬ જી.બી. કિંમત રૂ. ૪૫૦/- (૨) ૪ જી.બી. કિંમત રૂ. ૧૮૦/- તથા સેમસંગ કંપનીનું મેમરી કાર્ડ (૪) ૮ જી.બી. કિંમત રૂ. ૩૦૦/- ની ગણી શકાય તથા સનડીસ્ક કંપનીના પેન ડ્રાઈવ (૧) ૧૬જી.બી. કિંમત રૂ. ૪૫૦/- (૨) ૧૬જી.બી. કિંમત રૂ. ૪૫૦/- (૩) ૮ જી.બી. કિંમત રૂ. ૩૦૦/- તથા એચ.પી. કંપનીની પેન ડ્રાઈવ (૪) ૩૨ જી.બી. કિંમત રૂ. ૮૦૦/- ના હતા તથા ક્વીક કંપનીનું એસ.એમ.ડી. (હીટ મશીન) જેની કિંમત રૂ.૨૫૦૦/- ના મળી કુલ્લે કિ.રૂ. ૬,૨૪૦/- જેટલાના મત્તાની એસેસરીઝ તથા અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ ૨૭ જેની આશરે કુલ કિંમત રૂ.૫૩,૧૪૭/- ની ગણી શકાય જે તમામ મળી કુલ્લે કિંમત રૂ.૫૯૭૫૭/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી ઉપરોક્ત મોબાઇલ ચોરીનો ગુન્હો ડીટેક્ટ કરેલ છે